https://archive.org/details/bk760/page/n0/mode/1up

1916 -Gupt Panth ka Shujra (760)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

૭૯૬

# ગુપત પંથકા શુજરા.

( એક જુનો હસ્ત લિખિત લેખ )

છપાવી પ્રગટ કરનાર

એદલજી ધનજી કાબા

અમરેલી–કાઠીયાવાડ.

ઇ. સ. ૧૯૧૬

ધી " ઓલ્સે પ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ " બક્ષી કુવા રોડ અમરેલી માં મેનેજર એદલજી ધનજી કાબાએ પોતાના માટે છાપ્યું છે.
તા. ૧૬—૬—૧૬

કીમત ત્રણ આના.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n1/mode/1up

# Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk760/page/n2/mode/1up

1916 -Gupt Panth ka Shujra (760)

realpatidar.com

૭૮૬

# ગુપત પંથકા શુજરા.

( એક જુનો હસ્ત લિખિત લેખ )

---

છપાવી પ્રગટ કરનાર

**એદલજી ધનજી કાબા**

અમરેલી–કાઠીયાવાડ.

ઈ. સ. ૧૯૧૬

ધી "ઓજસ પ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ" બક્ષી કુવા રોડ અમરેલી માં મેનેજર એદલજી ધનજી કાબાએ પોતાના માટે છાપ્યું છે.
તા. ૧૬—૬—૧૬

કીમત ત્રણ આના.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n3/mode/1up



realpatidar.com

# આગાખાની મત રક્ષણના પુસ્તકો.

**પચીસ સવાલોના જવાબો**— પેશાવરવાળા રાધાકૃષ્ણના પચીસ સવાલોના દંદાંશીકન જવાબો. કીંમત ત્રણ આના.

**ખુલ્લી ચીઠ્ઠીનો જવાબ**—રાધાકૃષ્ણે આગાખાન ઉપર ખુલ્લી ચીઠ્ઠી નામે બુક છપાવી તેનો દંદાંશીકન જવાબ. કીમત પાંચ આના

**આગાખાની ખુદાઇનો જવાબ**— મજકુર રાધાકૃષ્ણે હમણાં " આગાખાની ખુદાઇ " નામે આગાખાન વિરૂદ્ધમાં પુસ્તક છપાવ્યું છે તેનો આ દંદાંશીકન જવાબ છે ( છપાય છે ) કીંમત એક રૂપીઓ.

**આર્ય પ્રકાશની અજ્ઞાનતાનું ખંડન**— ભાગ ૧-૨-૩ મુંબઇમાંને પ્રગટ થતાં આર્ય પ્રકાશ નામના આર્ય સમાજી પત્રે સતપંથ વિરૂદ્ધ કરેલા લખાણનો હેરત ભર્યો જવાબ તથા આર્ય સમાજીઓની ભુલવણીમાં નાખનારી કપટ જાળમાંથી લોકોને બચાવવા માટે આર્ય સમાજીઓના અકાયદોની પોલ ખોલવામાં આવી છે. દરેક ભાગની કીમત છ છ આના.

લખો

**એદલજી ધનજી કાબા.**

**અમરેલી**-કાઠીયાવાડ

## પુસ્તકો બીલકુલ મફત

અમારાં પુસ્તકોના ગ્રાહક મેળવી આપનારને સેંકડે ૨૫ ટકા પ્રમાણેના તેની મરજીમાં આવે તે પુસ્તકો માત્ર પોસ્ટેજ લઇ મફત આપવામાં આવે છે. એક રૂપીઆથી ઓછી કીમ્મતનું ગ્રાહક મેળવી આપનારને તેવો લાભ મળી શકશે નહિ.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n4/mode/1up



realpatidar.com

# પ્રસ્તાવના

ખોજા કોમ તથા તેના ધર્મની ઉતપત્તીનો વિશ્વાસ પાત્ર હેવાલ હજુ હાથ આવી શક્યો નથી. તેના ઉત્પાદકો કોણ અને તેના વૃતાન્તો પણ અસાધારણ અંધારામાં રહેલ છે. તેના સંબંધમાં હમણાં સુધીમાં જે કાંઇ હકીકત મળવા પામી છે તે ખાત્રી પુર્વકની હોય તેમ માની શકાય તેવી નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, તે સઘળી બાબતોને યોગ્ય ન્યાય આપવા પુરતું ખોજા કોમ તથા તેના ધર્મનુ સાહિત્ય કોમે એકત્ર કીધું નથી. અને તે જ્યાં ત્યાં પુસ્તકના છુટાં પાનાની જેમ રવડતું પડેલું છે. માટે તે સઘળું એકત્ર કરવા ઉપરજ સત્ય હકીકત પ્રાપ્ત કરવાનો આધાર ટકી રહેલો છે અને તેથી તેવું સાહિત્ય જેટલું જેટલું હોય, જ્યાં જ્યાં હોય, અને જેવું જેવું હોય તે સઘળું એકઠું કરવુ એ બહુજ જરૂરનું છે. આવા અગત્યના કાર્ય માટે અમારો દસ વર્ષનો પ્રયાસ છે અને તેટલી મુદત દરમિયાન અમોએ તે એકઠું કરવામાં જીવતોડ પ્રયાસ કીધો છે અને હજુ પણ તે પ્રયાસ ચાલુજ રહેલો છે અને તે પ્રયાસ હેતુનુ મોતી પ્રાપ્ત થતાં સુધી ચાલુ રાખવો એ બહુજ જરૂરનો ધારી, અમોએ આ " ગુપત પંથકા ગુજરા " નામે એક હસ્ત લિખિત લેખ સુરતના એક માતબર ખોજા ગ્રહસ્થ પાસેથી મેળવી તેને છપાવ્યો છે, કે જે ખોજા કોમ તથા ધર્મની ઉતપત્તી તથા સ્થિતિ ઉપર અસાધારણ અજવાળું પાડે છે, આ લેખ અમોએ માત્ર ઉપરનો પવિત્ર હેતુ પાર પાડવાને માટે પ્રગટ કીધો છે અને તે સિવાયનો બીજો કોઇ હેતુ અમો દ્રષ્ટિ મર્યાદામાં રાખતાજ નથી. આશા રાખવામાં આવે છે કે આ લેખ અતિ આવકારદાયક થઇ પડશે.

આ લેખનો લખનાર કોણ છે તથા તે કોઇ પણ વખતે છપાયો પણ છે કે નહિ, તેની અમોને કાંઈ પણ ખબર નથી; પરંતુ આ લેખ જે અમો છાપી પ્રગટ કરીએ છીએ તેથી તે સબંધે જે જે બેરાદરોને માહિતી

realpatidar.com

realpatidar.com

હશે, તે તે અમોને તેના લખનાર તથા, તે જો કોઈ વખતે છપાયો હોય તો, તેના છપાવનારના નામો મુળ કાપી સાથે પુરાં પાડશે તો, અમો તેની બીજી આવૃતિમાં તે સબંધે હકીકત પ્રગટ કરીશું. આશા રાખવામાં આવે છે કે આ ભલામણને યોગ્ય ઇનસાફ આપવામાં આવશે.

આ હસ્ત લેખની કાપી અમોને જેવી મળવા પામી છે તેવીજ અમોએ છપાવી છે. કોઈ કોઈ શબ્દો તેમાં એવા ગડબડીયા હતા કે, જેને અમો બરોબર ઉકેલી શક્યા નથી તેથી તેને સાધારણ રીતે જેવા વાંચી શકાયા તેવાજ અમોએ રહેવા દીધા છે; પરંતુ અમોએ ઉપર જે ભલામણ કીધી છે, તે ઉપર જો બેરાદરો લક્ષ આપશે તો, તે સઘળી ખામીઓ બીજી આવૃતિ પ્રસંગે નીકળી જવા પામશે.

કોઈ પણ બેરાદર પાસે ખોજા કોમ તથા તેના ધર્મને લગતા સાહિત્યના હસ્ત લિખિત કે છાપેલા, એવા લેખો હોય કે, જે હજુ કોમની જાણમાં ન આવવા પામ્યા હોય. તો તે જો અમોને જોવાને મોકલવાની કૃપા કરશે તો, તે જો છાપવાને લાયકના હશે તો, અમો તેમ કરી કોમી સાહિત્યની લાયબ્રેરીમાં ઉમેરો કરીશું અને તેમ થતાં કોમને બેહદ લાભ થશે. આશા રાખવામાં આવે છે કે આ બાબતને પણ નજીવી ગણવામાં આવશે નહિ.

અમરેલી
તા. ૧૪-૬-૧૬

એદલજી ધનજી કાબા.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n6/mode/1up



realpatidar.com

૭૮૬

# ગુપત પંથકા શુજરા.

[illegible]

realpatidar.com

https://archive.org/details/bk760/page/n7/mode/1up





realpatidar.com

સીવાએ દુસરે કોઈકું માલુમ નહિ થી, કે યેહ ગુર હરીચંદકા બેટા હએ. જહાંસે ગુપત પંથકા મનસુબા હુવા સં ૧૪૭૨ મે, કહું કે જાડે મારગી દીન નવે ધરમમે કહા હએકે આગું નીકલંકી દસવાં અવતાર પછમ દેસ સે ના મેગા ( યાને હોગા ) સો વહાંસે અબ જગાતે હૈં સો સુનીઓ.

ઉસ રોજ પીર સદરદીન કે નામ સે ઓર આગા ઇસલામશા કે નીશાન સે, ઓર સોહોદેવ જોશી કે શાસત્ર સે. વકીલ કપુર નીજામ દીન ગુર હરીચંદ કે નાએબ ગુલ ગુલને ઇસ ગપત પંથમેં નીકલંકી દસવેં અવતાર કું, પછમ દેસ સે ખડા કીઆ હએ, ઉસ રોજ છત્રીસ કુલકે તીન મુખી કુ સંમજાનેક લીએ, યેહ હકીકત ગુજરી હએ, સુલકે પંજાબ કે ઉચ સેહેર મેં, સો સુનીઓ.

કહા હએ કે એક સોહોદેવ જોસી નાગકા બંમન બડા પંડીત થા. ગુર હરીચંદ કા બેટા ઓર ઉસકે મોહો પર સારદાબી થા. ઓર ઉસકી જબાન ખુબ શીરીન હકનતદાર થા. વોહ મુસલમાન હુવા થા ઓર આપકુ શેખ ફરીદ કેહેલાનાથા ઓર બારા બરસ હુવે કે, અનદર લટકા થા ઓર બારા બરસ લાકડે કી રોટી પેટ પર બાંધાથા ઓર બારા બરસ વંન પાન ખાતે થે ઓર ચોરાશી ધરમ કે તરીકે દેખે થે ઓર દુસરા એક નામે કપુર હીન્દુ લવાના થા, વો અપની જમાત મેં બડા મુકાદમ થા ઓર વો સોહોદેવ જોશી કા બી મુરીદ નાએબ થા, ગુર હરીચંદ કે વખતકા. ઇન દોનુકી પીર સદરૂદીન કે સાથ મહોબત મુલાકાત બોહોત કરથી તબ પીર સદરૂદીન ને સોહોદેવ જોશી કું કહા કે, તુમ મુસલમીન કાંયું હુવે ઓર દીનકા ગોહર કહાંસે હાંસીલ હુવા. તબ સોહાદેવ જોશીને કહા કે પઠાન લોગુસે હમ મુસલમાન હુવે ઓર શેખ બના ઓર શેખ અતાર સે હમકુ દીનકા ગોહર હાસીલ હુવા તબ પીર સદરૂદીન ને કહા કે, દીનકે ધરમેં બડી મજા હએ, એસી મજા હીન્દુમેં નહોગી. તબ સોહોદેવ જોશીને કહા કે, હમકુ હીન્દુમેં બી બડી મજાહ થી તબ પીર સદરૂદીન ને કહા કે હએસી મજાહ થી. તબ સોહોદેવ જોશીને હીન્દુકે ધરમકા સારા બીઆન પીર સદ્ ન સે કહા ઓર કહા કે નીકલંકી દસવા અવતાર તો આગુ હોને વાલા હએ. ઓર અબતો નવ્વા બુધા અવતાર ચલતા હએ, કઈ આગુ કેહે ગએ હએ. હમારા દાદા વૃધર વીઆસજી. તબ પીર સદરૂદીન ને બી દીન મહંમદી કા સારા બીઆન સોહાદેવ જોશી કે સાથ કહા ઓર કહા કે જબ માલીઆ ને હમારે

realpatidar.com

https://archive.org/details/bk760/page/n8/mode/1up





realpatidar.com

દાદા અલી કે સાથ ખીલાફતકા દાવા કીઆ હૈ ખીલાફત મેરી. બાદ પુછી હવે દોનોં કી લડાઈ હુઈ સો પાંચ પેઢી તલક ૧ અલી, ૨ હસન ૩ હુસેન ૪ જેનુલ આબેદીન ૫ મહમદ બાકર બાદ જબ છઠી પેઢી હમારા દાદા ઇમામ જાફર સાદક હુવા, તબ હિંદુ ઔર ને શીઆ મજહબ ચલાયા. બાદ જબ સાતવીં પેઢી, હમારા દાદા શાહ ઇસમાઇલ ઔર મુસે કાજમ એ દોનું ભાઇ હુવે, ઇમામ જાફર સાદક કે બેટે. તબ હિંદુ કે મુરીદોંને મુસાકાજમકો ઇમામ કર માના ઔર હમારે દાદા શાહા ઇસમાઇલકુ નહીં માના. તબ દોનું ભાઇઓમેં હેત પ્રીત નહિ રહીઆ ઔર મુરીદોંમેં બડી અદાવત હુઇ. તબ હમારા દાદા શાહા ઇસમાઇલ જમીન વાર્ને યમનકી તરફ જાકે રહે. ઔર મુસે કાજમ જો સાતવીં પેઢી ઇમામ હુવા, ઉસ પીછે મુસરેજા ઇમામ હુવે. ઉસ પીછે મહંમદ તકી ૯ મેં ઇમામ હુવે. ઉસ પીછે ૧૦ વેં અલી નકી ઇમામ હુવે. ઉસ પીછે હસન અસકરી ૧૧ વેં ઇમામ હુવે. ઉસ પીછે મહંમદ મેહેદી ૧૨ વેં ઇમામ હુવે. સો આખરે કે કુવે કે અંદર ગએબ હોગએ લોક આજ કેહેતે હએ કે, કુવે કે અંદરસે નીકલેંગે ઔર આખરી જમાનેમેં કે ઇમામ મેહેદી કેહલાવેંગે. યે બારા ઇમામ તમામ હુવે ઔર હમારા દાદા શાહ ઇસમાઇલ જો સાતવીં પેઢી યમન કી તરફ થા ઉસકે તીન ફરજંદ હુએ જાહેર શાહા તો છોટેપનમેં ફોત હુવે થે ઔર હમારે દાદા નુર મહંમદને અપને બડે ભાઇ મહંમદ બીન ઇસમાઇલકું ઇમામકી તરીકે મેં ઇમામ ઠેરાકે. ઔર અપને બેટે પીરે શનદર ઇમામ દીનકું અપને બડે ભાઇ મહંમદ બીન ઇસમાઇલકે પાસ છોડકે, આપ નીકલે મુરીદ કરનેકું, સંવત ૯૪૦ મેં ઔર યહાં આપકા નામ નુરદીન રખાયા. સો દેલમ દેશ ઇરાક મુલક મેં તબરેજ ઔર ખુરાસાનમેં મુરીદ કીએ ઔર બલખ બુખારે બદકશાન મેં મુરીદ કીએ. અતલાઇ ઔર ખુરાસાની, ઉનકું ઇમામ બતાયા, મહંમદ બીન ઇસમાઇલ ઔર ગુહાંસે પીરાણુ પટણ સહેરા જેસંગ કે રાજમેં આકે મુરીદ કીએ, જેપાલ જોષી કે જજમાનોકું, બમન બનીઆ કણબી સે, સો વોહોરે લોક હુવે. ઉનકી જનોઇ પાંચ મણ પાકા તોલે ચડી. ઉનોકું ભી ઇમામ બતાયાથા મહંમદ બીન ઇસમાઇલ. ઉનોમેં સે કાકા કેલા ઔર કાકી કેશીલા નામ વોહોરે લોગુમેં મશહુર હએ. ઔર જેપાલ જોષી ( યાને અસલમેં જાનીપા જોષી ) કા નામ અબ્દુલ મહમદ ખલીફા રખા ઔર યહાં આપકા નામ મૌવલાના હુસેન મશહુર રખાયા. ઔર વોહોરે લોક કેહેતે હએ કે, મહંમદ બીન ઇસમાઇલકા બેલચી આઇઆ થા. ઉસકે સાથ નાર આઇ થી. ઔર ઐસે લોક કેહેતે હએ કે, સતગુર નુરકે સાથ ચાર

realpatidar.com

https://archive.org/details/bk760/page/n9/mode/1up





realpatidar.com

મુસાફર થે. ઔર વહાંસે નવસારીમેં આકે આપકા નામ સઇઅદ સા-
દાત રખાએઆ ઔર પાંચ મુખી કે સાથમીલકે મુરીદ હોએ રાજા સુરચં-
દ મહુદેવી બાલેકું ઓર ઉસકા બેટી પાલઝુંદે કું અપની શાદીમે લાએ
બાદ આપ હક હુવે, પાંચ મુખી કે હગેસે ચરગતકે બાંટાકા બાના સંવત
૯૭૫ મેં. બાદ દરગાહ ઉપર કાકા મુજાવર બેઠા. અબ હમારે દાદા
શા ઇસમાઇલકે બડે ફરજંદ મહમદ બીન ઇસમાઇલ કી ઓલાદ સુની-
એ. ૯ સાખીઆ તાએમ ૧૦ રજી આહામદ, ૧૧ વફી મહમદ, ૨ તકી આ
હમદ, ૧૩ મેહેદી અબદલ્લા, ૧૪ કાએમ, ૧૫ મનસુર, ૧૬ મોહીજ, ૧૭
અઝીઝ, ૧૮ હાકમઅલી ૧૯ જાહેર હસન ૨૦ મુસ્તનસરબીલ્લા. એ આગ-
એબ. વોહોરે લોક કહેતે હએ. યહાંસે વહોરે લોક મુસ્તાંકે તાબે હુવે. ૨૧
શાહા નીઝાર, ૨૨ શાહા હાદી, ૨૩ શાહા મોહતદી, ૨૪ શાહા કાહેર, ૨૫
અલા ઝકરીએ સલામ, ૨૬ અલાઉદ્દીન મહમદ, ૨૭ ખુદ જલાલુદીન, ખુદ
હસનકા બેટા નહી થા ૨૮ રૂકનુદીન ખુરાસાની બીકાતા લીઆ થા. જાતકા
શેખ, ૨૯ શમશુદીન મહમદ, ૩૦ અલાઉદીન ૩૧ મોમંન કાસમ શાહ, ૩૨
ઇસલામ શાહા બત્તીસમી પેઢી. અબ કેક મે રેહતેથે, શા. રૂકનુદીન ખુરાસાની
કી ઓલાદ ચોથા પેડી, ૩૨ ઓર શેખ સના ઓર શેખ અતાર સો રૂક-
નુદીન ખુરાસાનીકે મામેકી ઓલાદ ચોથા પેડી. અબ હમારે દાદા શા
ઇસમાઇલકે છોટે ફરજંદ નુરમહંમદ નવસારી વાલેકી ઓલાદ સુનીએ.
૯ પીર કાનદર ઇમામદીન ૧૦ પીર મહમદ મનસુર ૧૧ પીર આહામદ ૧૨
પીર અબદલ મજીદ ૧૩ પીર મુસતફે સરબીલ્લા ૧૪ પીર આહમદ હાદી
૧૫ પીર હાશમ શા ૧૬ પીર માહામુદ ૧૭ પીર મહમદ ૧૮ પીર મોહે-
બદીન ૧૯ પીર ખાલક દીન ૨૦ પીર અબદલ મોમન ૨૧ પીર સલાહદીન
૨૨ પીર સલાઉદીન ૨૩ પીર શમસદીન ૨૪ પીર નસીરદીન ૨૫ પીર સાહે-
બદીન ૨૬ પીર સદરદીન છવીશમી, પેડી સો હમ હએં. અબ યહાં ઉચમેં રે
હેતે હએં. અબ હમકુ સુન્ની શીઆ દોનુ નહી માનતે હએ. કીસ લીએ કે
આઆવીઆકી અદાવતસે હમકુ સુન્ની નહી માનતે હએ, કીઉં કે હમ
અલીકી ઓલાદ હએં ઓર મુસે કાજમકી અદાવતસે હમકુ શીઆ નહી
માનસે હએ, કીઉં કે હમ શાહ ઇસમાઇલ કી ઓલાદ હએ. તબ સોહોદેવ
જોશીને કહા કે, અબ અપન દોનુ મીલકે એક દુસરા દીન મઝહબ ખડા કરે;
હીન્દુઆની ઓર મુસલમાની ભેદ દોનું ગડબડગુટા મીલાકે. તબ પીર સદ-
રૂદીન ને કેહા કે, બેહોત ખુબ. તબ બુધકા શીસ ઠેરાએઆં સો શાનીકો.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n10/mode/1up





realpatidar.com

શ્રી અનાથ, આધ, અતીમત, આધં, હંવ કંવ, ધરમ, તેખ, તત, નાથ ભાતરા, હરી તક, ખરૂરત્રા, અંત અતીત, પરેમ રૂખ, વંદ્ર શ્રી મછ, કછ, વારા, નરસીંગ, વાહામન, ફરસરામ, રામ, કાન, કાનકા પરીખત ઓર પરીખત તો પાનડવકી ઓલાદ, ઓર જાદવકી ઓલાદ તો ફના ફાની હોગએ હએ, યું હીનદુ લોગ કેહેતે હએ, તો કાનકા પરીખત કીઉં હુવા જાને બુધ્ધા અવતાર કું પંડવોકે ઘડરસે ખડા કરને કું કાનકા પરીખત ઠેહેરાયા સો સુનીએ કાનકા પરીખત, જનમોજએ, સેસાનંધ, સતાનંધ, વીશુ વધુ રાજ, વંશ શ્રી બુધ. ઓર બુધકા શીશ ઓર શીશતો દાદા આદમ કા બેટા ખજ દીન દાર લોગ કહેતે હએ તો, બુધકા શીશ કીઉં હુવા. જાને નીક- લંકી અવતાર કું હાસમી ધારાનેસે ખડા કરનેકું બુધકા શીશ ઠેહેરાએઆ હએ સો સુનીએ. બુધકા શીશ શામ, મલક, સલામ, એમલામ, હારાન (એટલે હારૂન) સાગાન, સાઝાન, આધાન, નીજાર, મીજાર, એલીઆસ, માલક, મધરૂક કઝીમ, કુર્નાન, નસરીત, ફહઆલ, ગાલબ લબેકાબ, મુરાદ, કઝીમ, મુતલર, અબ્દ મુનાફ, અબુ હાશમ ઓર ઉમૈયા. ઉમૈઆ કે હુલમ, હુલમ કે સુરીઆન. સુરીઆન કે માવીઆ. ઓર અબુ હાશમ કે અબુ મુતલેબ. ઓર અબુ મુતલેબ કે અબુ તાલેબ ઓર અબદલા ઓર અબદલા કે નબી મહંમદ સલલ હાએ સલવાતુલા અલે હે વસલમ. ઓર અબુ તાલેબકે અલી મુશકીલ કુશા શેરે અઝદાં ઓર અલી સાહેબકું વીશનજીકા નીકલંકી અવ- તાર ઠેહેરાએઆ ઓર નબી સાહેબકું સતગુર બરમાજીકા અવતાર ઠેહેરાએ- આ. ઓર બાવા આદમજીકું તીસરા દેવ ઇશવરજીકા અવતાર ઠેહેરાએઆ સો સુનીએ.

જીરે બાઇરે આજ કલજુગ માંહે ઇશવર આદમ નામ ધરાએઆ.
ગુર બ્રહ્માને નબી મહંમદ કહાવીઆ હોજીરે બાઇ.
જીરે બાઇરે પુરખ ઉતંમ વીશનજીએ અલી રૂપે નામ ધરાએઆ,
તેનો નામ રીખીસરે પાએઆ હોજીરે બાઇ.

તબ ઉસ વખત સંવત ૧૪૭૬ મે સને મહંમદી ૮૩૬ હીજરી હુવે થે. તબ કાહાં અલી થા ઓર કાહાં મહંમદ મુસતફા થે. ઓર કાહાં બાવા આદમ થા. બાદ આગા ઇસલામશાકું શ્રી ઇસલામશા આરખી રૂપે અલી અલાહ ઇમામ મેહેદી નીકલંકી દસવાં પાત્ર અવતાર વીસનજી સેતરદીપ દેલમદેશ એરાક ખંડે ગઢ આલમોત, કેકપુરી, હેમપુરી ઠેહેરાએઆ.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n11/mode/1up





realpatidar.com

( ગીનાન પહેલા )

કસપુર, મમપુર, શામપુરમે કુવા. હેમપુરમે તખત રચાએઆ.
મૌવલાના શ્રી ઈસલામશા વારે કેરો પુરખ સરેવો મેહેદીએ ઈસલામશા

( ગીનાન દુસરા )

મોમના તે જે ભરાંત છોડેશે. એજી અલખ પુરખ શા જીવેંજે દાતાર
અલખ પુરખ સાહેબ સરણીએ સતાર સીરેવો શ્રી ઈસલામશા દસમો અવતાર.

( ગીનાન તીસરા )

આસાંજી સેંતર દીપ એરાક ખડે ગણુસર (ઘદરસર) વધાઈઉ,
અલી અવતરેઆજી અલી નામ નીરંજન ભણીએ.
શ્રી ઇસલામશા જુગ પરવરેઆ હરી અનંત.

ઓર પીર સદરદીનકુ બાર કરોડકા ખાવંદ નેમ બોધ દેનેવાલા સાચા પીર સુખી નુર નીજાર નબી મહંમદ સતગુર બરમાંજી જગત ગુરૂ જંબુદી પમેં ઠેહેરાએઆ સો સુનીએ:—

( ગીનાન પહેલા. )

જીરે ભાઇ આ જુગ સરજીને ગુરે ગીનાન એ સુણાઇયાં
ભાઇ નુર સતગુર સુદી જમપુમેં આએઆ હો જીઓજી

( ગીનાન દુસરા )

હો જીરે ભાઇ અનદુકારે પેહેલા નબી મહમદ સોઇ
ગુર જંમપુદીપમે આએઆ એક જીઓજી

( ગીનાન તીસરા )

એજી પીર સદરદીન નબી મહંમદ કહીએ
જેણે પરતક શા દીખલાએઆજી

ઓર કપુરકું વકીલ, નીજામદીન બાવા આદમ, તીસરા દો ઇશ્વર શાહજીકા અણે આર ઠેહેરાએઆ સો સુનીએ:—

( ગીનાન પહેલા )

જીરે વીવા ઇશ્વર શાહજી પાસે અણે આર દોએ સેતો વીવા—જીરે વીવા.
સોહેવ જેશી શાહની ઓરી ઓતરે સેતો વીવા— જીરે વીવા

realpatidar.com

https://archive.org/details/bk760/page/n12/mode/1up



realpatidar.com



( ગીનાન દુસરા )

જીરે ભાઈ કામતો પાળીઓજે સાહેજે નામ એ ધુરાંધો!
ભાઈ એ કે મુરત ત્રેઈ સચા દેવ હોજીઓજી

( ગીનાન તીસરા )

જુગમેં હીરે શાહજી મુનેરી આ પીરવકીલ ગતીએ
ચહર વાખાઈજી ગદ આસમોત દેખાડેઓ.

ઓર સોહદેવ જોશીકે હીનદુઆને નામકું પીર સદરૂદીનકે નામસે નામ મીલાકે એક મેક કીઆ ગીનાનમેં. કીઉં કે જાહેરીમેં તો વોહ સોદેવ જો શી નહી થા, ઓર બાતીનમેં (પણ અતરે જોઈએ બાતીનમેં ) તો વોહ શો ખ ફરીદ થા. વજે તો .ઇલાહેદેકા ઇલાહેદા રહા, ઓર સોહદેવ જોશીકે જો હીનદુઆને નામ યે, સો સબ હીનદુઆને નામ પીર સદરૂદીનકે હો ગએ. સો સુનીએ:—

જીરે ભાઈ કરે ગુર હરીચંદ હર કેરી વાણી, (પણ જોઈએ વાડી )
ગુર સોહદેવ સીંચણ હાર
જીરે ભાઈ ભણીએ પીર સદરદીન સચે શા ગુરજી વાણી (જોઈએ વાડી)
ગુર સોહદેવ સીંચણ હાર

ઇસ રીતે ગુપત પંથ ખડા કીઆ. ઓર ઇસ પંથકા નામ સતપંથ રખા. ઓર કહા કે ઇસ પંથકા પરદા ખોલના નહી, સો સુનીએ:—

એજી સતપંથજે પડદો જે ભાર ( જોઈએ જન )
ખોલે તેનો જીવડો દોજખે જાએસે હોજી

હીદુઆનીસેભી નીકાલા ઓર મુસલમાનીસે ભી નહી મીલાએઆ ઓર ઇસ ગુપત પંથમેં લટકતા રખા. સો સુનીએ:—

રોવે રોવે હીનદુડા જે ન મુસલમાના,
રોવે બામણ જોશીડા જે વાંચન પોથ પુરાના.
રોવે મુલ્લાં કાજીડા જે પડન કુરાના,
રોવે કુડા સુનીડા સચે શા ન પીછાણ્યા.
રોવે રોવે સનસારી એ સગલા રોવે,
એક ન રોવે જેણે શાહ પીર પાયા.
બાલગુર બોલીઆ જી એ પીર સાહેબં દીન.

realpatidar.com

realpatidar.com

ઔર ઉસ વકતમેં પીર સાહેબદીન તો ગીજનીમેં લકડીઆં બેચ બેચ કે હક હુવે થે સો ગીનાન બોલનેકુ કબ આએથે. ઔર જેતા કેતા હીન-દુઆના શાસ્ત્ર બડે મારગી વીશનવા ધરમકા થા ઉસકુ ઇસ ગુપત પંથકે ધરમસે મીલાઇઆ. સો સુનીએ:—

( ગીનાન પહેલા )

કારણ જાણો તમે સત પીછાણો તો બાલગુર યું ફરમાએઆ
શા પછમેં પાત્ર નીકલંકી નારાયણ સતપંથ શામ સીધાએઆ

( ગીનાન દુસરા )

આસાંજી હેમપુરીમેં તખત રચાએઆ, તીઆં કોને ન જાએ કલેઆજી
ગુર બરમા પીર સદરદીન પોતા તે ઢુંઢ ઢુંઢ કર ગલેઆ, હરી અનંત

ઔર જો સીધી હરદ હએ સો સીધમેં ખોજોંકે પાસ, વએભી સેહદેવ જોશીને ખડે કીએ હએ. કીયું કે છુપેલે દીનકે હરએકભી છુપેલે, ખાસ લીએ કે ભેદ દુસરે કોઇકુ માલમ ન હોવે. ઔર સબ શાસ્ત્ર છુપેલે હરફોમેં લીખકે તેયાર કીયા. બાદ કપુરને સુરંદોકું બડે મારગી વીશનવી ધરમમેં સે ઇસ ગુપત પંથકે ધરમમેં લાએઆ, સો સુનીએ:—

આસાં જુગ ઉપર છાની રાખા મતીએં બે લખાએઆ
હેક મન રખીએ જાન કેઓ
આસાં હંમહી ઉમેદવાર હજરત ચાલણુ
મલો એ મલો દુઆ રખીએ જાન કેઓ

ઔર દસોંદ દાન સતકા પછકા ઠેહેરાએઆ. સો તુલશીએ ઔર સામદાસને કબુલ નહિ કીઆ. ઔર ત્રીકમને કબુલ કીઆ સો સુનીએ:—

આસાંજી છત્રીસ કુલ પુરા ધરમી શ્રી ઇસલામશાહકું સભારેજી
દસોંદ કારણ જીવ દુલાએઓ
તે ચોવીસ ચાલીઆ ઘોહોર અંધાહારે હરી અનંત
આસાંજી દસોંદ ન દીધી ને, કીરીઆ કીધી, તે સતી હુવે આસારજી
દસોંદ વીના મુળ ઉખડી જાએસે તે જાએસે ઘોહોર અંધાર, હરી અનંત

( ગીનાન દુસરા )

એંજી પછમે આએઆ શા પરતક પાએઆ
ભુલીઆ.રે ગાફલ જેણે જનમ હારાએઆ
સેરેવો શ્રી ઇસલામ શા દસમો અવતાર.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n14/mode/1up



realpatidar.com



બાદ જો હીન્દુ રહા ઉસકુ ગુપતી ઠેહેરાએઆ. ઓર જો મુસલમાન હુવે ઉસકુ મોમન ઠેહેરાએઆ બાદ જબ ઝોળી તૈયાર હોતીથી તબ દુસરે કોઈકુ હુકમ નહિથા જાનેકા. ઓર આપ જાતે થે, સો બરસ દીનકી મુસાફરી કરકે પીર પીછે આતેથે ઓર કેકમે નહિ જાતેથે કીયુ કે અપની પંજેદારકે વાસ્તે મુરીદ હોઆથે, ઓર મુરીદકુ સમજાતે કે હામિ નીશાન કેકકા બતાએ થા થા. ઓર જબ આતેથે તબ આગા શ્રી ઇસલામશા કી તારીફ એસી કરતેથે કે જયસી તારીફ પરવરદીગારકી તબ વોહ મુરીદ કહેતેથે કે, હમકુ હુકમ હોવે તો હમભી દીદાર દેખનેકુ ઉમેદવાર હએ. તબ ફરમાતેથે કે આગા સાહેબ બડાં ઉચ મુલસતાનમેં આવેગે. સો. સુનીએ:—

(ગીનાન પહેલા)

ઉંચ આવેગો આગો ગઢ મુલસતાન, પુરે શા પરીઆન,
નગારાં સાહેબકી વજદા આંછ,

(ગીનાન દુસરા)

આશાંછ બાબુશ અનુરત કુદરતી છાજે
નર કાસમશાહ રાએછ પાંચ નદી મુલ્લસતાન
મુલસતાન માંહે છે તીઆં દસ્ત કાલીંગાને ધાએ હરી અનંત
આમાંછ મુલ રોકે શા તખતજ એસે, રામ રાજ તીઆં સેરીછ
નીચનું રૂપે નીશાનને વરશે, ઇમામ રૂપે ફલ દેશે હરી અનંત

(ગીનાન તીસરા)

આવશે શાહ મુલસતાન માંહે, શાહ દેશે તે રોખીઆને રાજ
રીખીયુ કરશે તે અવીચલ રાજ, રંખીઆંને વહીકુંટ વાસ

યું કર મુરીદકું સમજાતે થે; ઓર ઝોળીકી બાંટકે આપ આકીબત કરતેથે બાદ યુ કરતે જબ સોહદેવ જોગી હક હુવે. સવંત ૧૫૨૫] મેં ઓર સંવત ૧૫૨૦] મે કપુર હક હુવે. ઓર સંવત ૧૫૨૫] મેં પીર સદરૂદીન હક હુવે તબ પીર હસન કબીરદીનને અનંત કરોડ કા વાલી આપકુ આપ ઠેહેરાએઆ. ઓર કપુરકે બેટે ઇસ્માગુલકુ બાંટા ન દીઆ, તબ ઇસ્માગુલને ખામોશ દીઆ કીયું કે સમો વરતે તે સાતબાન. અબ યુ કી કરતે જબ પીર હસન કબીરદીનકી આખરીકા વખત હુઆ, તબ આપને ભા.ઇ પીર તાજદીનકું વકીલ કારભારી કુલ ઠહરાઈઆ.

realpatidar.com

realpatidar.com

કરાએઆ. ઔર અપને અઠારે બેરમેં પીર રેહેમતુલાશાકુ પીર મુખી ઠેરાએઆ. ઔર પીર ઇમામશાકુ પટા દેકે આપ ઠઠ હુવે સંવત ૧૫૩૪ખુ મે. તબ પીર ઇમામશા અવલ સીંધમે આએના. ઔર ઉમામદીકુકે જમાતખાનેમેં જાકે ખીમતરા કીઆ. ઔર વહાં તીન દાંદે નીકાલે. આકુબત સીધાઓને તીન બારાબત (માને તીન મરતબે) દસત દરાજી કરકે જમાતખાનેમેં સે બાહીર રવાને કીઆ. એ પેહેલી બરકત બાટેકી. બાદ પરેમજી ખોજેને પીર ઇમામશાકુ તીન ફાંકોકા રોજા ખુલવાએઆ અપને ઘરકુ. બાદ પીર ઇમામશા સીંધકુ છોડકે ગુજરાત બીચ પીરાણે ગામ મેં આએ. અમદાવાદકે પાસ સંવત ૧૫૩૬ખુ મેં. વહાં નવસારીસે કાકા નોના આએઆ થા. ઉસકે સાથ મીલકે મુરીદ કરને લગા. ગુપત પંથકી પેરવીસે. બાદ જબ પીર તાજદીન ઔર પીર રેહેમતુલાશા એ દોનું ચીચે મતીજે સીંધ બીચ કોટડા ગામમેં આએઆ. તબ કારભારીઓને જમાતકુ જાહેર કીઆ કે, જો માલ ખાવંદકા હુએ સો સબ પીર તાજદીનેં આપ આર્શીઅત કર જાતા હુએ. ઉસકા મુદ્દ દેખો. ઝોલી પર નામ ખાવંદકા હુએ, ઉસ ઝોલીકા પેહેરાન સીલવાકે આપને મુબારક કીઆ હુએ. તબ સનદીઓને પીર તાજદીન પર ગલબા કીઆ, તબ આપકે દીલમેં દરીઆફ કીઆ કે અબ તો એ મુરીદ લોગ હુરમત પર આએ. તબ આપકે દસ્તકી ઉંગલી મને સોનેકી અંગુસ્તરીથી ઉસમેં જો હીરાકણી થી, સો ગોહોમેં બાહાકે ઔર ઉપરસે ચાદર ખેચકે પલંગ પર આરામ કીઆ. સંવત ૧૫૪૪ મેં. એ દુસરી બરકત બાટેકી. એકત્રીસ બાઈસ બરસકી ઉમરથી. ઔર ચાંદ બદર જએસા ચેહરા થા. ઉસ દીનસે ઝોલી કેકકુ ચલી. ચોવીસવા પેડી આગાશા અબ્દ સલીમકે પાસ. કીયું કે મુરીદોકુ સમજાનેકે વાસતે આગા શ્રી ઇસલામશા કે નામકી ઝોલી ઠેરાઈથા, સો ન આગા ઇસલામશાકુ મીલી, ન આગા મુસતફીઝર બીલ્લાકુ મીલી, કીયું કે આપ ઉધરાકે આપ આશીઅત કરતેથે, સો પીરો વહીલોંકી આંપ આપકી અદાવતસે આગા સાહેબ અબ્દ સલીમકુ મીલી. એ તીસરી બરકત બાટેકી. આપકા કાકા આપકુ આડા આએઆ, તો આપભી મોહોતાજ હુવે. બાદ દસ બીસ ખોજે તબાર હોકે આગાશા અબ્દ સલીમકે પાસ ગએ. કેકમેં ઔર ઝોલી સપારકે પીરકા તલબ કીઆ, તબ આગાશાહ અબ્દ સલામને કહા કે " પીર ન દારી તો સુમાર મુરીદ કી કરદે અસાત " તબ સીંધીઓને કહા કે, હંમકુ તો પીર સદરદીનને મુરીદ કીએ હુએ. તબ

realpatidar.com

https://archive.org/details/bk760/page/n16/mode/1up





realpatidar.com

આગાસાહેબ અમદ સલીમને કહા કે, " શ્રી તોર મુરીદ કરકે અરત " તબ સાંગીઆને ઇસ ખુદા બોલ સુનાએ, સો સુનીએઃ—

આસાં માછ, કોરંભ, વારા, ભણાએઓ, નરશી રૂપે શામીજી વીસન અખે
આસાં વામનજ, ફરશીરામ સોઇ અવતરેઓ શ્રી રામે લંકાં ગઢ લીઓ.
આસાં કાનજી, બુધ દખણુ અવતરેઓ, અઢારે ખોણી શાદા નર વારેઓ,
સો આ કાળમે પાત નીકલંકી નારાએણ દેસમ દેસમે શાહને થાન રચેઓ.
આસા કરોડીતે પંજ સત નવ બારો અમુત મેં તારી ધો
શ્રી ઇમામશાહ સાંજો નામ ભણાએઓ.

તબ આગાસાહા અમદ સલીમને કહા કે, ઇસકા માયના તુમને તુમારે પીરકુ પુછા થા, તબ સાંગીઆને કહા કે ખબર ( યાને નહીં ). તબ આગાશા અમદ સલીમને કહા કે, તેના અઉઝોબીલ્લા. બાદે નોહો સદો ચ્યાર બાદ દીન ફુરકે દર દુનીઆ મી બશાદ, અગર હમ ન જા ગે ફરંગે ખર. ભાઇ નાહક બાકે માને સુખનરા ન પુરસીદ ' ઇસકા માએના હી નહીંમેં સુનીએઃ—

અગર શ્રી મહમદી ( યાને હીજરી ) ૯૦૪ બરસકે પીછે બીચ દુની આકે ફેર હોતા હએ. અગર જો ઉસ જમા બોલઃ વોહ ખર બલક નાદાન થા કે, માઝના આ સુખનકા નહીં પુછા. બાદ જબ કારભારીને આગાશા અમદ સલીમકુ કહા કે, હલાગલાહકી આએઆતમે અલ હને ફેર માઅના હએ કે જો મુજે નહીં પહેચાને ઉસ સાથ ચડાઇ કરકે ઉસે સબ કાપને વાના ઓર ઉસકા ધનન, ઓલાદ ભી ખાના હલાલ હએ. બીન ન કાહી તબ આગાશા અમદ કશમને પંજીઆત જોગરદી લીખવાકે દીઆ કે એ તુમારા પીર હએ. ઇસ પર અમલ કરીઓ. દેખો એ તમારા પીર કબીરદીનકે પદરકા કે પદરકા પીરતનજો પી. હસન કબીરદીનને, પીર રહેમ તુમારા દીયા થા, સો પીરતંન આગાશાહે અમદ સલીમકે ફરજંદમેં આઇ. સવંત ૧૫૪૪ કે પીછે એ ચોથા બરકત બાહેરી. ઇસ પર સાહેદ હએ. પીર પંજીઆત જોગરદી. આગાશાહે અમદ સલીમકે ધદરકા એલમ ફારસી જુબાની, સો પીર તાજદીનકે પીછે પીર પંજીઆત જોગરદી લખા હુવા. હએ પારેકી પેડીમેં જોકે દેખા બાદ આરાદીન જમરદીન વકીલ હુએ. સવંત ૧૫૮૫ મેં ઓર દો ચાર સીધી ખોજે વારસ હુવે. બાદ સાધમે

realpatidar.com

https://archive.org/details/bk760/page/n17/mode/1up





realpatidar.com

જીસકે પીર રહેમતુલાશા પાસસે કારભાર ફિરતનકા છીન લીઆ. એ ધું અપની બરકત બાટેકી. બાદ પીર રેમતલાશા સીંધકુ છોડકે, ઓર ઉંચ મુલ સતાનસે હોકે ગુજરાત ભણી કડી ગામમેં આએઆ બેતે મુખીકે સાથ કીયું કે પીર ઇમામશાકી ઘરવાલીને બેતે મુખીકુ ભેજકે, પીર રેમતુલાશાકુ બુલવાએઆથા. અપની બેટીકી સાદી કરનેકે વાસતે ઉસ વખત પીર ઇમામશા હક હુવે થે ઓર સૈયદ મહમદશાકુ બાદશાને અપની બેટી બીઆકે તખત પર બેઠાએઆ થા. ' અમદાવાદ " મે અપને બેટેકી જગા પર, ઓર આપ બાદશા હક હુવે થે. બાદશાહી હવાલે કરકે બાદ સૈયદ મહંમદશાને અપને ચીચ બાવાકુ કડીસે બુલવાકે ઇજત આબરૂસે અપની બેહેનથા સો અપને ચીચરે ભાઇકુ બીઆકે, ઓર અપને બાવાકી જમાત થી, એ બી દીતી કે, ખાઓ પીઓ, અમન અમાન રહો. બાદ સૈયદ મહંમદશાને પાંચ હરકતકે બદલે " સતવેણી " લીખવાકે સીધીઓકું લીખવા દીતી, ઉસમેં લીખા હુવા હએ કે,

" વલી મુસાએક જો કેહલાવે, દોકડે દમળો જીવડા લાવે.
સુધા કાફર ઉસકુ જાનો સએતાન રૂપ તમે દેખ પીછાણો.

એ સુનતેહી ( યાને ઇસ લીએ ) સીધીઓને કેહસે લાદી લીખવાકે સયદ મહમદશાકે ઉપર લીખવા દીતી, તબ સયદ મહમદશાને અપને દી લમેં કહા કે, દગા નહિ કીસીકા સગા જબ હમારે દદા પીર સદરૂદીનકે નામસે ઓર આગા ઇસલાગશાકે નીશાનસે, ઓર સોદદે જોસીકે શાસ્ત્ર સે વકીલ કપુર નજાગદીન, ગુરૂ હરીચંદકે નાએબ ગુલગુલને ઇનો મુરીદકુ દગાબાજસે કેહમેં 'ખુદા બતાએઆ હએ, તો કીઆ ઓર જગા ઉનકુ પડા " ખુંદા તો વાહેદ હુ લાશરીક, સબ જગા મોજુ હએ. " તબ એ તકસીર તો હગારી હએ. કીયું કે હમને બી સતવેણીમેં કહા હએ કે,

ખુદા ખાલક જાનો અલહા, સો તો જાનો મુસતકિસર બીલા.

ઓર આયું બી હમારે દાદા પીર નુરમહમદ નવસારીવાલેસે લેકે તા હમારે દાદા પીર સલાહદીન તલક, ઇન સબો સાહેબોને મુરીદ કીએ હએ. અતાઇલા ઓર ખુરાસાની, ઉનકું બી કેહમેં ઇમામ બતાએઆ હએ. ઇસમા કુછ વરીદા, ઓર આપ તો બારા ઇમામકુ ઇમામ કર માનતે હૈ. ઇસે

realpatidar.com

https://archive.org/details/bk760/page/n18/mode/1up





realpatidar.com

ઇમામકા તરીકા જાહેરી મઝહબ. અએસી હમાઆઉસે આપકા બી તરીકા ઓર, પીર મુરિદોકા બી તરીકા ઓર. બાદ જબ પીર ઇમામશાકે મુરીદો કું એ બાત માલુમ હુઇ કે, સયદ મહમદશાકું ખાવંદકે ખત આએ હએ. તબ મોડ સબ જમાત જમા હોકે આએ કે, હમકુ ખાવંદકે ખત સુનાઓ કે, ખાવંદને કીઆ ફરમાયા હએ. તબ સયદ મહમદશાને કહા કે, તુમારે ખાવંદને ફરમાઇઆ હએ કે, સતગુર બરમાઉઉ નબી મહમદ પીર - દદીન ગુર હરીચંદ, સતગુર સોહદેવ, બાલ ગુર સોહદેવ. પીર હસન કબીરદીન સો તુમારા ગુર ઇમામશા પીર હએ. ઓર નીકલંકી દસવાં પાત્ર અવતાર વી સાનઉ અલી અલ્લા, ઇમામ મેહદી શ્રી ઇસલામશા, સો તુમારા ખાવંદ નર મહમદશા ( યાને નુર મહંમદશા ) હએ. ઓર ફરમાઇઆ હએ કે, જમાત બી બાદીસ કીઆ હું આપકે તઈ, કયું કે, આપકે ઘર ફરજંદ હુએ ઉસકી મુબારકબાદકે વાસ્તે ઇતા હદીઆ લીખા હએ, સો આપકુ મુબારક. ઇતની મહેરબાની કરી હએ આગા સાહેબને. તબસે પીર ઇમામશાકી જમાત નર મહંમદશા ( નુર મહમદશા ) પાસ કાએમ રહી, તો સૈદોકુ બી દીદા મી લતા હએ. ઓર જો મુસાફીર આતા હએ. દરગાહ પર ઉસકુ બી ખાનેકુ મીલતા હએ બાદ જબ આરાદીન જમરદીનકુ હમીર સુમરેને કતે બાગમેં કહીદ કીઆ. સંવત ૧૫૪૬ મે તબ અવ્વલ પીર દાદુ ખએરસે જો વ કીલ હુવે સંવત ૧૫૪૭ મેં આગા ગરીબ મીરજાકે વખતમે. સો આગા મુરાદ મીરજાકી આખરી તલક. બાદ પીર દાદુ ખએરમે પીર હુવે સવંત ૧૬૦૫ મેં આગા બુદરઅલીકે વખતમે. સો આગા ઝુલફીકારેઅલીકી આ ખરી તલક. દેખો એ તમાશા પીર સદરૂદીનકે ઘરકી પીરતન જો આગાકે ઘરમેં આથી બાટેકી બરકતસે પીર રેમતલશાકી પીરતનસે, પીરતન પીર દાદુ ખએરસેકુ મીલી; કયું કે આગા મુરાદ મીરજાકે પીછે સાડનીસની પે- ઢી કારબારીઓને બુદરઅલીકુ બોજુકે ખુદાકી જગા પર ખડા કીઆ. ઇ સ લીએ પીર દાદુ ખએરસેને બી બોજુકે નબીકી જગાકા મરતબા પાએ આ સો ફરમાન સીંધીઆને નહિ માના, તબ પીર દાદુને કહા કે પીર સ દરદીનકે નામસે ઓર આગા શ્રી ઇસલામશાકે નીશાનસે, ઓર સોહદેવ જોશીકે શાખસે વકીલ કપુર નજમદીન ગુર હરીચંદકે નાએબ ગુલગુલને તુમકુ મુરીદ કીએ, ઓર તુમ તો હમકુ નહીં માનતે હો. તબ સીંધીઓને કહા કે હમકુ તો પીર સદરૂદીનને મુરીદ કીએ, તબ પીર દાદુ ખએરસેને કે

realpatidar.com

https://archive.org/details/bk760/page/n19/mode/1up





realpatidar.com

હા કે, પીર સદરદીન તો શીઆ મઝહબી થા. ઓર શીઆ મઝહબી તો હીંદુકા હાથકી કોઇ ચીજ નહીં ખાતે હએ. ઓર પાની બી નહીં પીતે હએ, ઓર કેહેતે હએ કે હીંદુ લોગ તો નજીસ લોગ હએ, તો તુમકુ પીર સદરદીનને કીસ તરેહ મુરીદ કીઆ હએ, ઓર ગીનાન સાઅમે જોતે કેતે નામ હએ સો રુબ નાગ સોહદેવ કંસીકે હએ, સો સુનીએઃ—

સતગુર કહેરે ગઇ ગઇ બાતાં કીઆ કરો, અને હાજર ના બુજો ભેદ,
બાર કરોડીઉં લહી (લઇ) ચાલેઆ, એવા સાચા ગુર સોહદેવ.
સતગુર કહેરે પીર સદરદીન સાંચજ કહેઆ. અને મોમન તમે બુજો ભેદ
ચારે જુગ ના જીવ ભુલીઆ, એમ બોલીઆ દેવ સોહદેવ.

તો બી સીંધીઓને નહીં માના. બાદ પીર દાદુ ખએરસે સીંધકુ છોડકે કચ્છ હાલારમેં આએઆ. અપને તરફકે ચાલીસ ઘર સાથ લેકે સંવત ૧૬૦૬ મેં. ઓર મુરીદ કરને લગે. કચ્છ હાલારમેં ગુપત પંથકી પેરવીસે ઓર ઉનકિ મુરીદોંકે ઉપર પેટાંદ ઠેહરાઇ. બાદ જબ પીર દાદુ ખએરસે હક હુવે સવંત ૧૬૫૦ મેં. તબ બાવા સાહેબ સલદાર વકીલ હુવા. પીર દાદુ ખએરસેકા બેટા ઓર સીંધકા બી કારબાર આપકે હાથ કીઆ. સવંત ૧૬૫૨ મે. બાદ જબ સૈયદ કડીવાલે ઓર પીરાણેવાલે બોહોતસે હુવે. તબ સબીકા ગુજરાન એક જમાતમેં હો ન સકા, તબ સૈયદ કડીવાલે જાકે સીંધ જમાતસે મીલે. ઓર ગીનાન બોલને લગે, સો સુનીએઃ—

એજી કાએમ શામી શા કેકમેં બેઠો, અલીઅ રૂપે અવતારજી
પાત્ર સાંતોતેર ઇનામ ચાલીસમેં, પરતક શાહો નીજારજી.

તબ સીંધીઓને કહા કે અએ મુરશીદ સાહેબ, આપ ખાવંદકે પાસ જાના, ઓર વહાંસે હુકમ લાના તો આપકે તઇ આંખુસે દુવા દી જાએ. તબ સૈયદ સાબરઅલી આગાશા નીજારકે પાસ ગએઆ કેકગે. તબ આગા શા નીજારને કહા કે, એ અખતીઆર તો વકીલ મીર ખુદાદાદકે હાતમેં હએ. તબ સૈયદ સાબરઅલી વહાંસે પીછે ફીરકે કચ્છ ભુજમે આએઆ. વકીલ મીર ખુદાદાદકે પાસ. ઉસ વખત વકીલ સાહેબકી ઘોડી, વા ( માને પવન) મે રે ગઇ થી ઉસકુ દવા દારૂ ખીલાકે હુશીઆર કીઆ, તબ વકીલ મીર ખુદાદાદને રાજી હોકે સયદ સાબરઅલીકુ સીંધકા કાગજ દીઆ. દેહેરે જમાતકે ઉપર, તબસે એ દુવા ચાલુ હુઇ હએ સયદ કડીવાલુંકી. બાદ

realpatidar.com

https://archive.org/details/bk760/page/n20/mode/1up





realpatidar.com

[illegible] કરીવાલોકા સીંધમેં આના જાના બોહોતસા હુવા, તબસે વકીલોકી [illegible] સીંધમેં મોકૂફ હુઈ. બાદ જબ વકીલ સાહેબદીન ઓર વકીલ સલામદીન એ દોનું ભાઈ બેહથીયે હુવે, કચ્છ ભુજમેં વકીલ સવાઈખાન [illegible] બેટે. તબ વકીલ સાહેબ દીનકે તો તીન બેટે થે. એક મીર, દુસરા મહંમદ, તીસરા માલકજી. ઉનું તીનો ભાઈઓમેં બાવા મીર સાહેબને તો રાહો સાહેબકી ગોલી વીરબાઈથી જાતકી ખવાસ ઉસકુ લાકે અપને ઘરમેં રખી. ઈસ બાતકી રાહો સાહેબકે સાથ આંટી પડી. તબ વકીલ સલામદીન [illegible] અપને બેટે બાવા ભાઈધણજીકું સાથ લેકે રાહો સાહેબકે સાથ મીલ ગયા, કે હમ તો તુમારે હુવાગે હએ. ઓર વકીલ સાહેબદીનકુ તો રાહો સાહેબકે કામદાર [illegible] વાણીયેને જુદી મદદ દગાબાજકી કરકે ભુજસે બાહેર રવાના કીઆ. સો વકીલોકી સારી દરબારકુ જલાકે કંટારીઓમેં જાકે બેઠે ઠાકોર કાદીઆજીકે પાસ સવંત ૧૬૭૨ મેં. ઓર ચઉદ બરસ તલક રાહો સાહેબકે સાથ લડાઈ કી. કીયું કે વકીલ સાહેબ દીનકે પાસ [illegible] ખબ્બીસ પ સ છે પેઢીકા પૈસા ખોજુકે ધરમકા જમા હુવા થા. કચ્છ, હાલાર ઓર સીંધકા. કીસ લીએ કે, ખોજુકે ખુદાકુ તો થોડાક હદી આ ભેજતે થે. સપર ( યાને સીપર ) શમશેર ઓર તનખા. દુસરા રાજ [illegible] જમા કરતે થે. ( યાને આપ જમા કરતે થે ) સો સબ વકીલ સાહેબદીનને વીરબાઈકે વાંધેમે રાહો સાહેબકે સાથ ચડાઈમેં ઉડાએઆ. બાદ જબ વકીલ સાહેબદીન હક હુવે સવંત ૧૭૭૫ મેં. તબ મીર મહંમદ માલકજી એ તીનું ભાઈ કંટારીઓસે નીકલકે હાલારમેં જાકે બેઠે, તબસે ખોજુકે ધરમકા પૈસા કચ્છ ભુજમેં રાહો સાહેબ ખાણેકુ લગા, વીરબાઈકે વાંધેમેં. સો સવંત ૧૭૮૯ તલક ખાએઆ. બાદ જબ વકીલ માલકજીને હાલારસે કાગજ લીખા કચ્છ ભુજમેં, વકીલ ભાઈધણજીકે પાસ, કે અએ ભાઈજી, તુમ હમારી તરફસી રાહો સાહેબકે સાથ સલાહ કરાના, તો હમ કચ્છ ભુજમેં આવે અએસે કાગજ પર કાગજ બહોતસે લીખે. સો સબ કાગજ વકીલ ભાઈધણજીને રાહો સાહેબકે હજુરમેં હાજર કીએ. તબ રાહો સાહેબને કહા કે, ઈનોકું હમારે મુલકમેં આનેકા હુકમ નહીં. બાદ જબ વકીલ ભાઈધણજીને રાહો સાહેબકે હકમેં બહોતસી દુઆ ફરમાઈ, તબ રાહો સાહેબને કહા કે તુમ જાનો. તબ વકીલ ભાઈધણજીને કચ્છ ભુજસે કાગજ લીખ હાલારમેં વકીલ માલકજીકે પાસ ભેજે. કે અએ ભાઈજી તુમ

realpatidar.com

realpatidar.com

કેધારસે કુચ્છ ભુજમેં આના. હમને તુમારે તરફકી રાહા સાહેબકે સાથ સલાહ કી હએ. તબ વકીલ માલકજને પાંતીસ કોરી ખરચ કરકે તલવાર કુ ઝેહરકા પાની પીલવાએઆ. તબ વાગણીએ હકીમ ખોજે દામજી પરખા નકે દાદે ખટાઉકે બાપ સોમજી તેજાને વકીલ માલકજીકુ કહા કે, અએ બાવા સાહેબ, એ કામ નહીં અછા. તબ વકીલ માલકજીને ખોજે સોમજી તેજાકુ રજા દીઆ. તીસ બરસકા કારભારી થા. પીછે વકીલ માલકજી ઓર બાવા પીરમહંમદ એ દોનુ ચચે ભતીજે હાલારસે કચ્છ ભુજમેં આએ. સલાહ કરનેકુ વકીલ બાએધજીકે પાસ, સલાહ કરકે ગએ ડુબકા (ટપકા) કે ડુંગરમેં મીજબાની ખાનેકુ. સો મીજબાની ખાકે વકીલ માલકજી ઓર બાવા પીરમહંમદ, ઇન દોનુ ચાચે ભતીજેને આધી રાતકુ અવલ બાએધ જીકે દોનું બડે ફરજંદુંકું શહીદ કીઆ. ભર નીંદમેં સોએ થે, નવ જવાન લડકે. એક રહીમદીન, દુસરા સાદકજી. પીછે વકીલ બાએદજીકુ શહીદ કી આ. હાથમેં તસબી લેકે વજુમેં થા, સો અએસાજ નીકલા ઝોલા આ ગએઆ થા. ઓર બાવા અલાદાદ સાત બરસકા લડકા સાથ થા, વએ ભી ગોદમેં સોએઆ થા, ઉસકુ ભી સતરે ફુલ સમશેરકે કરકે, વકીલ બાએધજીકી ગોદમેસે નીકાલકે ખએરકા ટેરા કે ઝાહાડ પર ઉછાલ દીઆ. ચાર જખમ ઓર ભી કીઆ. બાદ આપ દોનુ રવાને હુવે, વાગણુકે તરફ. સો ધ્રાગણુકેકે ગઢમેં જાકે છુપે. સવંત ૧૭૯૦ મેં. સો ફીરીઆદ રાહા સાહેબકે પાસ પહોંચી. તબ રાહા સાહેબને ધ્રાગણુકેકે ગઢ પર તોપખાના ભેજા. તબ વકીલ માલકજી ઓર બાવા પીરમહંમદ ઇન દોનો ચાચા ભ તીજેને દેહસતકે મારે આપકા જાન આપહી જેરસે નીકાલા ગલેમેં ફાંસા ખાહાકે. બાદ દોનુંકું રાહા સાહેબકે પાસ લાકે, ઓર પાંચુંકું પીર દાદુ ખ એરસેકે રોજેમેં રખે. ઓર બાવે અલાદાદકે શીકમોકે જખમોકુ ભી રેશમ ડોરસે સીવાકે ઓર દવાદારૂ, મલમપટી કરકે હએઆત રખા ખુદા ઓર રાહા સાહેબને, ઓર આપ રાહા સાહેબને પીર અલાદાદકુ ફરમાઇઆ કે અએ પીર સાહેબ, "બ ફરમા હરચ મે ખાઇ બ બંધા" તબ પીર અ લાદાદને ખોજુંકે ધરમમે કે પૈસેકા તલબ કીઆ. સો રાહા સાહેબને તાંબેકે પતરમેં લીખવાકે પીર અલાદાદકું બક્ષીસ કીઆ. કે આજ દીનસે આપકુ આરીઅત. સવંત ૧૭૯૬ મેં. ઓર એક સતકે પહેકેકી દસોંદ સીવાએ જોવે દેતે ઓર કાએદે હએ સો સબ સીખીઓને ખડે કીએ, સો સાંભળે

realpatidar.com

https://archive.org/details/bk760/page/n22/mode/1up





realpatidar.com

કેબી, ગોબે, ગોપકે, દફતર, સમર, છાંટે, મઝને પરને, છઠી, મુનડકે કાટો કુંપી, બાકી, બુકી. સાર ગુર, ચાંદરાનો, પીરાનો, દરીઅ.બક્ષ, ગુલ ફુલ, ખુદાબાદકો કાંગો, માતા સલામતકી મોહોર. એ સબ કાએદે સીખી બાતે ખાકે કીએ. ઔર મુવેકા સમર સુનીએ. કહા હએ કે, મુરહીસકે ઘર મેં મૈયત હુઇ થી ઔર ઉસકે ઘરમેં કતી ફુરસત ન થી. જો ઉસ મયંતકા કામ ખલાસ હોવે. બાદ સમર ઉચરાકે ઉસ મયતકા કામ ખલાસ કી ગઇ. બાદ જબ ઉસકે સગેવાલેકું એ બાતકી માલુમ હુઇ, તબ વોહ સમર સામ લેકે આએ કે જમાતને ઘણી મહેરબાની કરી, ઔર બી મહેરબાની કરકે આપકા હક આપ લેના. તબ કોઇને સંમરકે પૈસે પીછે ફીરા લીએ નહિ, તબ ઉનાને એ હોતસી આઝેજી કી, તબ સમરકે પઇસે જમાતખાને મેં દીલવાએ. તબસે એ ચાલ ચલી હુએ સમરકી મજકુર બીબાન પીરે મુસાબિબાલી શાહકે કીતાબમેં લીખા થા. અજન બીબીકે પાસ, ઉસમે સુ મેહેરાલી બગત મુદ વાલેને રાજપાર હીરા અંબારવાલેકુ લીખકે દીઆથા. ઉસમેં કાગરીએ ખવા ગએથે, ઔર પત્તે બી ફુટ ગએ થે. બાદ ઉસકા બાકા રાખમેં દીઆ હએ. ઔર જએસેદી નામ અલી નબીકે નામે નામ હએ કુરાન માવફક મુસલમાની. વએસહી નામ મુસલમાની સયદ કડીવાલો કે હએ. કીયું કે સયદ કડીવાલે તો અલી નબીકી એલાદ કહેલાતે હએ તો વએસેહી મુસલમાની નામ આપકે રખતે હએ; તો સતગુર સોહદેવ એ ૨ બાલગુર સોહદેવ, ઔર ગુર હરીચંદ એ બી હીન્દુઆને નામ પીર સદર દીનકે કહેતે હએ, તો વએસે હીન્દુઆને નામ તો સયદ કડીવાલે આપકે નહીં રખતે હએ; કીયુ કે અપને દાદે પીર સદરદીનકે જો હીન્દુઆને નામ હોતે તો આપકે બી હીન્દુઆને નામ રખતે. મગર એ હીનદુઆને નામ તો જાનતે હએ, સો નામ કીયું રખે આપદે. ઔર હસનપુરામેં કહા હએ કે, " આજ કલજુગ માંહે કેકપુરી નગરી સો ગુર નબી મહમદે વાટ દે ખાડી." ઔર નબી મહમદ તો મદીનેમે થે. ઔર અલી બી મદીનેમેં થે. ઉસ વખત કેકમેં તો પારસી થે, ઔર દુસરે કોન થે કેકમે, જો ગુર નબી મહમદ વાટ દેખાડી. પણ એ વાટ જીનને દેખાઇ હએ, ઉસકા નામ સુનીએ.

હરીહર સતગુર સોહદેવ રાહ બતાઇ, બાલ ગુર સોહદેવે દસ બતાઇ
ભારતી કીને નકલંકી તણી.

realpatidar.com

https://archive.org/details/bk760/page/n23/mode/1up





realpatidar.com

ઔર આરદ વંનોતરી ગાવંત્રીમેં કહા હૈ કે, મોલાકા સરસ્થાન તો દૈલમ દેશ, કેકપુરી નગરી ઔર ખેતર તો મુલતાન, સીતાપુર કોઆરકા મોલા કા જનમ વતન તો મકા મદીના, ઔર વફાતકા વતન તો કુફા, શાહ નજફ, ઔર સુન્ની કહેતે હૈ કે, ઇમામ મેહદી મકેમેં પયેદા હોવેગા. ઔર ફકીર લોક કહેતે હૈ. ઇમામ મેહદી ખાલક જનગરે ( યાને અબુ શેરની સામે ખારક જનગરો છે જહાં ગાર મહંમદ હનીફા કહેવાએ છે, ને તહાં ઘણાં જણ થઇ આવેલ છે. સોરે પણ દુરગાહ દેખત. (ક. પી. કરે બલાઇએ ) ગારમે સુ પયેદા હોવેગે ઔર શીઆ લોગ કહેતે હૈ કે, ઇમામ મેહેદી સામરેમેં કુવે કે અંદરસે નીકલેંગે. પન ઇમામ બારા તેરવાં ઇમામ નહીં. ઔર વેહોરે લોગ કહેતે હૈ કે, ગાયબ ઇમામ પડદે હૈ. પન ઇમામ બીસ એકવીસીવા ઇમામ નહીં ( અટલે વીસના ઉપર ઇમામ નથી ). ઔર ખોજે લોગમે તો ઇંતાલીસ ઇમામ હો ચુકે. ઔર હીંદુ લોગ કહેતે હૈ કે, નીકલંકી હોનેવાલા હૈ, ઔર ખોજે લોગોંમેં તો નકલંકી હો ચુકે. ઇસ પર એ બેત હૈ સો સુનીએ:—

જો કુછ દેખા હાને કાગજ અનુસે, ઔર જો કુછ સુનાથા અપને ગનુસે
સો સબ ગીનાનોસે દેખ પાએઆ, તા શુજરા સબ બરાબર આએઆ
ન દેવે તાને વોદ હમારે ઉપર. જો ઇસ શુજરેકુ પડેગા મગર
જો કુછ સુનનં દેખનંમે આએ હૈ, સો સબ ગીનાનોંસે દેખ પાએઆ હૈ
ચારસો બરસ ઉપરકી ભુલ, સો બેહલાગ કીઆ! સમજેગા ધુલ
ઇસ કેતાબકા નામ કીતાબ બેકીમતી, ઉસમે સતપથકા સુજરા પાએઆ

## વકીલોંકે નામ.

વકીલ કપુરકે તીન નામ. જનમ નામ કપુર, ઔર વજીરાત નામ નાએબ ગુલગુલ. ઔર વકીલાત નામ વકીલ નીઝામુદીન. ૨ વકીલ ઇબ્રાહીમ ગુલ બીન કપુર, ૩ વકીલ મહેમદીન ઉરફે મોરેબા, ૪ વકીલ ખૈરેદીન ઉરફે ખેતા, ૫ વકીલ મહંમદ આસર ઉર્ફે જેસર, ૬ વકીલ આરદીન જો મરદીન બીન મહમદ આસર ઉર્ફે જેસર, ૭ વકીલ પીર દાદુ ખજુરસેં બીન મહમદ આસર ઉર્ફે જેસર. ૮ વકીલ સાદક સલદાર બીન પીર દાદુ ખજુરસે, ૯ વકીલ ખીરખાંખાન બડા બીન સાદક સલધાર, ૧૦ વકીલ

realpatidar.com

https://archive.org/details/bk760/page/n24/mode/1up





realpatidar.com

પીર ખુદાદાદ બીન અબ્દુરખાન બડા, ૧૧ વકીલ સુલેમાનખાન બડા બીન પીર ખુદાદાદ, ૧૨ વકીલ સાલેહુદ્દીન ઓર વકીલ સલમદીન બીન સત્તાર ખાન બડા, ૧૩ વકીલ બાબાજી બીન સલામદીન, ૧૪ વકીલ પીર ખુદાદાદ બીન અબ્દુજી, ૧૫ વકીલ કમરદીન ઓર વકીલ દોસમહમદ ઓર વકીલ ખીદરખાન જુમાજી બીન પીર અલાદાદ, ૧૬ વકીલ પીરખાન ઓર વકીલ બુલુજી ઓર વકીલ પીર ઉમેદઅલી બીન ખીદરખાનજી જુમાજી.

## સલોકો.

સવંત સોલસોને છજ કહીએ, તીસ દીનકી હકીકત લઈએ, ૧
પીર દાદુ સીંધસે આએઆ, ગાલીસ ઘર સાથજ લાએઆ. ૨
કછ હાલાર કીધા આણ, પીરશાની આપી છે જાણું. ૩
સતગુર સોહદેવનો રાજ કહી, પીર સદરદીનને પરતાપ લઈ. ૪
કીધા મુરીદ કછ હાલાર, સબાગી દશે અવતાર. ૫
મછ, કછ વારા બાગી, નરસી નામ સર ચાળી. ૬
વાઓમન, પરસુરામ દોએ, રામ રાજાબી ગત જોઆ સોએ. ૭
કાન, બુધ દખણ આએઆ, નીકલંકી પાંચમે પાએઆ ૮
પહેલા હેતા દશા દસપુરમે, પીછે આએ આકાશ બગપુરમેં ૯
દુઆરકા શામપુરમે શાહ મલાઆ કેહ હેમપુરમે સોઈ મીલીઆ. ૧૦
ખડ દરાકે અતાં અવતરીઆ, શ્રી નકલંક શાહ રૂપે પરવરેઆ ૧૧
કેહપુરીમાં નીશાન ચડા છે, શ્રી નકલંક શાહ નામ બાજુતી ૧૨
બણો નામ મસતકી સર બોલ્યા બણો નામ અબદ સલીમ વદલા ૧૩
બણો નામ ગરીબ મીરજાં, બણો નામ મુરાદ મીરઝાં ૧૪
બણો બુદરઅલી નામ, કેહપુરીમે સોઈ શામ. ૧૫
સુણી આધીન બએ જે કેઈ, ગુપત પંથમે આવીઆ સોઈ. ૧૬
સુતાર, નડીઆ, કણબી, કુંભાર કાયથ, ચારણ, વેગન બણુશાલી સાર ૧૭
બેતાલીસ વરસજ પુરા, કીધા મુરીદ સતપથા શુરા. ૧૮
ગુપત પંથનો શખીક તાપ, પીરશાનો આપીઆ જાપ. ૧૯
કસોંદા રહે સીંધ મીંજાર, પેટાધી જાએ કછ હાલાર. ૨૦

realpatidar.com

https://archive.org/details/bk760/page/n25/mode/1up

1916 -Gupt Panth ka Shujra (760)



realpatidar.com

સવંત સોલસોને અડતાલી ભએઆ, તીસ દીન આપ ઇરાદા લીઆ ૨૧
પીર દાદુ જામનગરસે આએઆ. કચ્છ ભુજમે તશરીફ લાએઆ. ૨૨
પીર દાદુકી ઉમરકા સુનેઆ, એકસોને બાવીસ વરસ પુએઆ ૨૩
ચાર જણા પીર દાદુએ દીઆ, ચારેકા નામ સુભદાનીં મેહીં ૨૪
ગરીબ મીરઝાં જ કહીએ, મુરાદ મીરઝા જ લહીઅ. ૨૫
ખુદરઅલી કુ પાએઆ, અલી જુલફીકાર ભી આએઆ. ૨૬
વકીલાત કરી લીધ મંજુર, પીરતંન કરી કચ્છ હુશાર. ૨૭
સવત સોલસોને પચાસે હંસલ પીર દાદુ હુવે હક વાસીલ ૨૮
સવંત સોલસો ને એકાવને સાર, વકીલ હુવે સાદક હલદાર. ૨૯
વકીલ ખધરખાન ફકીર, વકીલ મીર ખુદાદાદ પીર. ૩૦
વકીલ સવાઇખાન ફકીર, વકીલ સલાગદીન પીર. ૩૧
વકીલ બાએધજી સૈઅદ ભએ, વકીલ અલાદાદ અગન રહે ૩૨
એકવીસ જખમ માલેકજીને કીએ તો ભી દેખો હકને હયાતી દીએ. ૩૩
રંજી કજા સબ રખાં ભઇ, મેહેરબાની રાહો સાહેબકી હુઇ. ૩૪
સંવત અઢારસોને બારેજ પુરા, ધરમસી ખોજા સતપંથી શુરા. ૩૫
સો દેખો જામનગરસે આએઆ કચ્છ ભુજમે ઇરાદા લાએઆ. ૩૬
પીર અલાદાદકે પડા પાઉ, હુકમ ફરમાવો તો રોજા બનવાઉં. ૩૭
પીર અલાદાદને હુકમ ફરમાએઆ ધરમશી ખોજેને રોજા બનવાએઆ ૩૮
આઠ બરસ કામ ચલા રોજેકા નેકનામ હુવા ધરમશી ખોજેકા. ૩૯
સવંત અઢારસો ને વીસમેં સાલ સોનેકે કલસ ચડાએ લાલ. ૪૦
કચ્છ હાલાર દેશ વધુવાએ, જમાડી જમાત સબ કોએ. ૪૧
મેવે મીઠાઇ સુખડી સાત વાની ખાઓ ભાઇજી ઉપર પીઓ પાની. ૪૩
ખાઇ પી સહુ થાનકે ગયા, રોજા રોશન પીર દાદુકા ભએઆ. ૪૩

## શીઆ લોગોંકે ઇમામ.

૧ અલી, ૨ હસન. ૩ હુસેન ૪ જેનુલઆબેદીન, ૫ મહંમદબાકર, ૬ જાફર સાદક. ૭ મુસે કાઝમ, ૮ મુસે રજા, ૯ મહંમદ તકી, ૧૦ અલી નકી, ૧૧ હસન અસકરી, ૧૨ મહંમદ મેહદી.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk760/page/n26/mode/1up





realpatidar.com

## વોહરે લોગોંકે ઈમામ.

૧ અલી, ૨ હસન, ૩ હુસેન ૪ જેનુલઆબેદીન, ૫ મહંમદબાકર, ૬ જાફર સાદક, ૭ ઇસ્માઇલ, ૮ મહંમદ, ૯ તાએમ, ૧૦ આહમદ, ૧૧ મહમદ, ૧૨ તકી, ૧૩ અબદીલ્લા, ૧૪ કાએમ, ૧૫ મનસુર, ૧૬ મોહીઝ, ૧૭ અઝીઝ, ૧૮ હાકમઅલી, ૧૯ હસં, ૨૦ મુસતઉિસરબીલ્લા.

## ખોજે લોગોંકે ઈમામ.

૧ અલી, ૨ હસન, ૩ હુસેન, ૪ જેનુલઆબેદીન, ૫ મહંમદ બાકર, ૬ જાફર સાદક, ૭ શા ઇસમાઇલ, ૮ મહંમદ બિન ઇસમાઇલ, ૯ સાદીઆ તાએમ, ૧૦ રજી આહામદ, ૧૧ વરી મહંમદ, ૧૨ તકી આહામદ, ૧૩ મેહેદી અબદલ્લા, ૧૪ કાએમ, ૧૫ મનસુર, ૧૬ મોહીઝ, ૧૭ અઝીઝ, ૧૮ હાકેમઅલી, ૧૯ જાહેર હસન, ૨૦ મુસતઉિ સર બીલ્લા, ૨૧ શા નીઝાર, ૨૨ શા હાદી, ૨૩ શા મોતદી, ૨૪ શા કાહાર, ૨૫ અલા જકરીએ સલામ, ૨૬ અલાઉદીદી, ૨૭ મહંમદ ખુદ જલાલુદીન, ૨૮ હસન કાધી, ૨૯ ખુરાસાની શમસુદીન, ૩૦ મહમદ અલાઉદીન, ૩૧ મોમનશા કાસમશા, ૩૨ ઇસલામશા, ૩૩ મુસતઉિસરબીલ્લા, ૩૪ અબદ સલીમ, ૩૫ ગરીબ મીરઝાં, ૩૬ મુરાદ મીરઝાં, ૩૭ જુદરઅલી, ૩૮ જુલરીકારઅલી, ૩૯ નુરધરઅલી, ૪૦ ખલીલીલ્લાહ અલી, ૪૧ શા નીઝાર, ૪૨ હસનઅલી. ૪૩ કાસમઅલી, ૪૪ અબુલ હસનઅલી, ૪૫ ખલીલીલ્લાહ અલી, ૪૬ હસનઅલી આગાખાન.

realpatidar.com

realpatidar.com

# એદલજી ધનજી કાબા તરફથી બહાર પડેલાં પુસ્તકો.

૧ હસન બિન સબ્બાહ, ૨ હસન બિન સબ્બાહ તથા ઇસ્માઇલી મીશન પ્રયોગ, ૩ હજરત મહંમદ, ૪ મીરઝા દબીર અનીસ, ૫ મુલ્યાં દો પ્યાજા, ૬ અબુ દુલામાના લતીફા. ૭ સર સઇયદ એહમદ, ૮ જસ્ટીસ અમીરઅલી, ૯ નવાબ મોહસીન-ઉલ-મુલ્ક, ૧૦ ફીરદોસે બરીં. ૧૧ તોબ તન નસુહ, ૧૨ શરાબ ખાના ખરાબ, ૧૩ કીસમતની બલિહારી, ૧૪ અ તવરનું સ્વપ્નું, ૧૫ શરાબનો દેવ, ૧૬ પાદરીનુ દેવળ ૧૭ કરમાલીનું કીસમત, ૧૮ મુસદસે હાલી ભાગ ૧ લો, ૧૯ મુસદસે હાલી ભાગ ૨ જો ૨૦ ઉમ્મતનો વિલાપ, ૨૧ ઇસ્લામીઓનો દીન્દને ધકો, ૨૨ અલ્લાહની ઓળખાણ. ૨૩ મોહરમની ખુબીઓ, ૨૪ થી ૨૭ મુસલિમ સદવર્તન ભાગ ૧–૨–૩–૪, ૨૮ ઇસલામી હકો. ૩૦ ઓલાદના હકો, ૩૧ ઇસલામના મોતી, ૩૨ ઇસલામી સીતારો, ૩૩ કુવ્વતે ઝુલફેકાર, ૩૪ આદાતે રસુલ, ૩૫ કરબલાના શુરવીરો, ૩૬ ઇસનાઅશરી મઝહબની ખુબીઓ, ૩૭ ઇસનાઅશરી આરસી, ૩૮ ઇસનાઅશરી તવારીખ, ૩૯ ઇસનાઅશરી ઇલમ, ૪૦ ચેરાગે ઇસનાઅશરી, ૪૧ ખોજા કોમની તવારીખ, ૪૨ આગાખાન કેસનો ફેસલો, ૪૩ ઇબરતે અફજા, ૪૪ જંગીશ હનો રીસાલો, ૪૫ ખોજા કોમને અપીલ, ૪૬ ખોજા કોમ અને સુધારો, ૪૭ ખોજા ખુન આરોપ, ૪૮ થી ૫૫ ખોજા પંથ દર્પણ ભાગ ૧ થી ૮, ૫૬ દરજ કોમના અકાયદ, ૫ ગોરાતલ ઓરૂસ, ૫૮ પચીસ સવાલોના જવાબો, ૫૯ ખુલ્લી ચીઠ્ઠીનો જવાબ, ૬૦ આગાખાની ખુદાઇનો જવાબ, ૬૧ થી ૬૩ આર્ય પ્રકાશનું ખંડન ભાગ ૧–૨–૩, ૬૪ થી ૬૫ સર સઇયદ એહમદના લેખો ભાગ ૧–૨, ૬૬ ઓરંગઝેબનું લેકચર, ૬૭ કેળવણીની હદીસો, ૬૮ વેપારની હદીસો, ૬૯ થી ૭૧ નુરબાઇનો કેસ ભાગ ૧–૨–૩, ૭૨ કરબલાના કીસ્સો, ૭૩ માતમે અલી, ૭૪ ખોજા ઉતપત્તી, ૭૫ ગુપ્ત પંથકા શુજરા, ૭૬ થી ૮૦ ખોજા પ્રકાશ વર્ષ ૧–૨–૩–૪–૫, ૮૧ ઇસમાઇલીમાંથી બાબી વગેરે

મળવાનું ઠેકાણું.

એદલજી ધનજી કાબા.

અમરેલી-કાઠીઆવાડ.

realpatidar.com